



“Save Electricity”
MADHYA GUJARAT VIJ COMPANY LTD.

Regd. Office : Sardar Patel Vidyut Bhavan,
Race Course, Vadodara - 390 007.

CIN No. U40102GJ2003SGC042907

Tele: (0265) 2310583-86

FAX: (0265) 2337918, 2338164

Website: www.mgvcl.com

Email : mgvcl@gebmail.com



**સૌર ઊર્જા સંચાલીત સિંચાઈ પમ્પ સેટ્સ ઉપલબ્ધ કરવાની યોજના ૨૦૧૫-૧૬ હેઠળ સ્વીચ ઓવર
અરજીઓ સ્વીકારવા બાબત**

હાલમાં સરકાર દ્વારા ખેતીવિષયક વીજ જોડાણ મેળવવા ઈચ્છુક અરજદારો ને સૌર ઊર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ ઉપલબ્ધ કરાવવાની યોજના જાહેર કરવામાં આવેલ છે.

અગાઉ તા. ૦૫.૦૫.૨૦૧૫ ની જાહેરાત મુજબ આ યોજના હેઠળ જે ખેડૂતો અગાઉ નોંધાયેલ સામાન્ય યોજના, આદિજાતિ તેમજ ડાર્કઝોન વિસ્તાર હેઠળ ખેતી હેતુના વીજ જોડાણોની સામાન્ય કમની અરજીને તબદીલ કરવા ઈચ્છતા હોય તેઓની અરજીઓ વીજ કંપનીની સ્થાનિક કચેરીએ સ્વીકારવાની તા. ૩૦.૦૬.૨૦૧૫ હતી તે તારીખ ૩૧.૦૭.૨૦૧૫ સુધી લંબાવામાં આવેલ છે. અન્ય મુદ્દાઓ અગાઉ ની જાહેરાત મુજબજ રહેશે.

ઉપરોક્ત અન્ય જે અરજદારોએ પોતાના નામે તા. ૩૧.૧૨.૨૦૧૪ સુધીમાં આદિજાતિ, ડાર્કઝોન અને સામાન્ય વિસ્તારની યોજનાઓ હેઠળ જે તે સ્થાનિક કચેરીમાં ખેતી વિષયક વીજ જોડાણ માટે અરજી નોંધાવેલ હોય તેવા અરજદારોએ આ યોજના હેઠળ વીજ કંપનીની સ્થાનિક કચેરીમાં તા. ૩૧.૦૭.૨૦૧૫ સુધીમાં, નોંધાવેલ અરજીમાંથી સૌર ઊર્જા સંચાલીત સિંચાઈ પમ્પ સેટ્સ અરજી તરીકે તબદીલ (ફેરવવા) કરવા માટે સાદા કાગળમાં સુવાચ્ય અક્ષરે અરજી કરવાની રહેશે. અને તેની સાથે રૂ. ૧૦૦૦ (એક હજારપૂરા) ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે, આ અરજી સાથે તેમણે અગાઉ નોંધાવેલ અરજી સાથે ભરેલ રકમ ની પહોંચની નકલ તેમજ ૭/૧૨, ૮-અ અને ૬-ક ના ઉતારાઓની અદ્યતન નકલ હયાત કુવાના દાખલા સાથે બીડવાની રહેશે.

પાત્રતા ધરાવતા અરજદારો પૈકી અનુસૂચિત જાતિનાં લાભાર્થીઓએ તથા ટ્રાયબલ વિસ્તારનાં અનુસૂચિત જનજાતિનાં લાભાર્થીઓએ પ્રતિ હોર્સપાવર રૂ. ૧૦૦૦/- ની રકમ ગ્રાહક ફાળા પેટે, દા.ત. ૩ હોર્સપાવર માટે રૂ ૩૦૦૦/- ભરપાઈ કરવાના રહેશે, અને તે સિવાયના અન્ય તમામ લાભાર્થીઓએ પ્રતિ હોર્સપાવર રૂ. ૫૦૦૦/- ની રકમ ગ્રાહક ફાળા પેટે, દા.ત. ૩ હોર્સપાવર માટે રૂ ૧૫૦૦૦/- ભરપાઈ કરવાના રહેશે. આ ઉપરાંત લાભાર્થીઓએ વપરાશ પેટે કોઈ બીલ ભરવાનું રહેશે નહિ.

આ યોજના અંતર્ગત વધુમાં ૩ હોર્સપાવર કે ૫ હોર્સપાવર ના કૃષિ વીજ જોડાણની માંગણી વાળા અરજદારો ઉપરાંત ૧૦ હોર્સપાવર સુધીની માંગણી વાળા અરજદારો પણ ત્રણ/ પાંચ હોર્સપાવરના સોલાર પમ્પ સેટ્સ માટે અરજી કરી શકશે.

સદર યોજના નો લાભ લેવા અંગે ની પાત્રતા તથા અન્ય ધારા ધોરણો અગાઉ તા. ૦૫.૦૫.૨૦૧૫ ની જાહેરાત મુજબજ રહેશે. વધુ માહિતી માટે સ્થાનિક કચેરી નો સંપર્ક સાધવો. આ યોજના હેઠળ ખેડૂતો તેઓની અરજીઓ વીજ કંપનીની સ્થાનિક કચેરીએ તારીખ ૩૧.૦૭.૨૦૧૫ સુધી નોંધાવી શકે છે. જે ખેડૂત સૌર ઊર્જા સંચાલીત સિંચાઈ પમ્પ સેટ્સ દ્વારા ખેતીવિષયક વીજજોડાણ મેળવવા અંગે સહમતી દર્શાવશે તેમને અગ્રતાના ધોરણે ખેતીવિષયક વીજ જોડાણ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ઇજનેર (સં અને નિ)
